

આત્મા યોજના અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોની આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયાની મુલાકાત

રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના દિવોદર, કાંકરેજ, ડીસા, પાલનપુર અને દાંતા તાલુકાનાં ખેડૂતોએ આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા ખાતે તારીખ ૧૧/૦૧/૨૦૧૯ ના રોજ મુલાકાત લીધેલ હતી.

ડૉ. જી. જે. પટેલ, યુનિટ અધિકારીશ્રીએ ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કરેલ અને અત્રેની કચેરીએ કાર્યરત આદિવાસી મહિલા ખેડૂત તાલીમ કેન્દ્ર, આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર અને પશુવિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત કરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓથી, છેલ્લા દસ વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ અને અત્રેના કેન્દ્ર દ્વારા ખેડૂતોપયોગી ખેતી પાકોની વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં કરવામાં આવેલ ભલામણોથી માહિતગાર કર્યા હતા. વધુમાં તેઓએ ખેતી પાકોમાં સુક્ષ્મ પિયત પદ્ધતિનું યોગ્ય રીતે અમલીકરણ અને તેના ફાયદાઓ જણાવેલ હતા.

ડૉ. એન. બી. પટેલ, તાલીમ સહાયકએ અત્રેની કચેરીએ ચાલતા વિવિધ અખતરાઓથી માહિતગાર કર્યા. તેમજ હાલમાં ગુજરાત રાજ્યમાં મકાઈના પાકમાં નુકસાન કરતી નવી ઇયળની (*Spodoptera frugiperda*) લાક્ષણિકતાઓ, તેનું નુકસાન કરવાની પદ્ધતિ ખેડૂતોને ખેતરમાં જીવંત નમૂનાઓ બતાવીને માહિતગાર કર્યા અને તેના નિયંત્રણ અંગેની સમજણ આપેલ.

પશુવિજ્ઞાન કેન્દ્ર યોજનામાં ફરજ બજાવતા ડૉ. ગુણવંત થોરાત, મદદનીશ પ્રાધ્યાપકએ પશુવિજ્ઞાન કેન્દ્ર સ્થાપવાના ઉદ્દેશ્ય, હેતુઓ અને છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલ વિસ્તરણની પ્રવૃત્તિઓ સાથે-સાથે સ્વચ્છ ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન અંગેની માહિતી આપેલ. ડૉ. થોરાતે કેન્દ્ર ખાતે આવેલ ફાર્મ પોંડની અને તેમાં કેવી રીતે પાણી સંગ્રહ કરવામાં આવે છે તેમજ તેના દ્વારા કેન્દ્ર પરના અખતરાઓમાં ઉપયોગીતાથી માહિતગાર કર્યા. મુલાકાતી ખેડૂતોમાં પી.વી.કે. દ્વારા પ્રસિદ્ધ કરેલ પશુપાલન ફોલ્ડરનું પણ વિતરણ કરવામાં આવેલ.

ડૉ. એ.વાય.માકાણી, રીસર્ચ એસોસિએટ એ ઘઉં અને ચણાના બીજ ઉત્પાદનની અને મરચી પાકમાં ટપક સિંચાઈ પદ્ધતિ પર ફર્ટીગેશન અને મલ્ટીંગના અખતરાની માહિતી આપેલ. શ્રી ડી. બી.રામજિયાણી, રીસર્ચ એસોસિએટ એ કેન્દ્ર ખાતે ફાર્મ પર આવેલ હવામાન વેધશાળાની ખેડૂતોને મુલાકાત કરાવી અને વિવિધ સાધનોની ઉપયોગીતા વિષે ખેડૂતોને સમજણ પૂરી પાડેલ હતી.

આત્મા યોજના અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોની આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયાની મુલાકાત

